

માધીનો છોકરો

અમારા આશ્રમમાં એક ઠાકરણનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કંતતાં શીખવ્યું અને દોઢ વરસે તેના સુતરમાંથી એક તાકો તૈયાર થયો. તાકો જોઈને છોકરો નાચતો નાચતો કહે : “મારી માધીને આપીશા મારી માધીને આપીશા!”

એના મુખ ઉપરનો મલકાટ નીહાળી મને થયું: આ છોકરાને માધી ઉપર કેટલો સ્નેહ છે! હું જાણતો હતો કે માધી તે બાળકની માતા નથી. એ છોકરાની મા મરી ગઈ તેથી માધીએ તેને ઉછેરી મોટો કર્યો હતો. બાળકનો માધી પરનો સ્નેહ દેખાતો હતો, પણ માધીને બાળક માટે કેટલો સ્નેહ છે તે જોવા જવાનો મને વીચાર આવ્યો.

એક વાર બાળકને લઈને અમારે પ્રવાસે જવાનું થયું. માધીને ગામ અમે તો ઉપર્યાં! માધીને ઘેર હું ગયો. તેણે મને પ્રેમથી આવકાર્યો. ઝાટીતુટી એક ગોદડી પાથરી આપીને હસતે મુખે સામે બેસી તે વાતો કરવા લાગી. ત્યાં છ-સાત વરસનો એક છોકરો આવીને ઘબ દઈને તેના ખોળામાં પહ્રયો. બાઈ તેને ખસેડવા ઘણુંય કરે, પણ પેલો તો વધારે ને વધારે વળગેલો રહે!

મેં પુછ્યું, “આ કોણ છે?”

માધી કહે, “વાણિયાનો છોકરો છે, મેં ઉછેરેલો.”

મેં પુછ્યું, “કેમ, તારે ઉછેરવો પહ્રયો?”

બાઈ કહે, “તેની મા સુવાવહમાં મરી ગઈ, ને બાળકને આપણાથી રેહું છોડાય?”

(માધી સુયાણી હતી.)

“શેઠે શું આલ્યું?”

“આલે શું? - મેં કંઈ લીધું જ નથી, મા’રાજ! વખતે મફત આપે તેથી ભુલેચુકેય તેની દુકાનના ઉંબરે ચહી નથી..” બાઈએ ખુમારીથી જવાબ વાય્યો.

“ત્યારે આ બાળક સાજુંમાંદું થાય ત્યારે દવાદારુ અંગે શું કર્યું?” મારા મનમાં તો હજુ આ બધું કોયારાસુપ જ હતું.

થોડીવાર અટકીને બાઈ કહે: “એ શું બોલ્યા, મા’રાજ? એવાં કેવાં છોકરાં ઉછેરીએ કે માંદાં થાય? માંદાં થાય તો કંનું ન કાપી કાઢીએ? મારું તો એકેય છોકરું કોઈ દી’ માંદું પહ્રયું નથી! માંદાં પહે તેવાં છોકરાં ઉછેરીએ જ શીદને?

—રવીશંકર વ્યાસ (મહારાજ)

—મહેન્દ્ર મેધાણી સંપાદિત

“અરધી સદીની વાચનયાત્રા” ભાગ-૧ના પાન૧૧૦ ઉપરથી, ઉંઝ જોડણી અને કલાપી ફોન્ટમાં....

ઑક્ટોબર ૦૮, ૨૦૦૫: ઉત્તમ ગજર, સુરત

